

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov - 2025 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો તફાવત સમજાવો. પરોક્ષ કરવેરાના પ્રકારોની સમજૂતી આપો. (૨૦)
 અથવા
- પ્રશ્ન.૧ જીએસટી વિષે વિસ્તૃત સમજૂતી આપી તેના ફાયદા અને મર્યાદાઓ ચર્ચો.
- પ્રશ્ન.૨ GST હેઠળ અવેજ સાથેનો અને અવેજ વગરનો પૂરવઠાનો ખ્યાલ વિસ્તાર પૂર્વક સમજાવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન.૨ GST હેઠળ સંયુક્ત (Composite) અને મિશ્ર (Mixed) પૂરવઠો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
- પ્રશ્ન.૩ ઉદાહરણ સાથે તફાવત સમજાવો: માલના પૂરવઠાના સમય સંદર્ભે ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જ (૧૫)
 અથવા
- પ્રશ્ન.૩ ઉદાહરણ સાથે તફાવત સમજાવો: સેવાના પૂરવઠા ના સમય સંદર્ભે ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જ
- પ્રશ્ન.૪ ટૂંક નોંધ લખો (કોઈ પણ બે) (૧૫)
- | | |
|-----------|-------------------------------|
| (1) એજન્ટ | (3) વ્યવહારનું મૂલ્ય |
| (2) અવેજ | (4) વ્યવહારમાં વટાવની બાદબાકી |

ENGLISH VERSION

- Que.1 Explain the difference between direct and indirect taxes. Explain the types of indirect taxes. (20)
- OR
- Que.1 Explain GST in detail and also elaborate its advantages and limitations.
- Que.2 Describe the concept of supply with consideration and supply without consideration under GST. (20)
- OR
- Que.2 Explain composite and mixed supplies under GST with the suitable examples.
- Que.3 Differentiate with illustration between Forward and Reverse charge in terms of time of supply of goods. (15)
- OR
- Que.3 Differentiate with illustration between Forward and Reverse charge in terms of time of supply of services.
- Que.4 write short note on; (any two) (15)
- | | |
|-------------------|--|
| (1) Agent | (3) Transaction Value |
| (2) Consideration | (4) Exclusion of discount from the value |
- *****